

08th September, 2023

To,
BSE Limited
Listing Department
Phiroze Jeejeebhoy Tower,
Dalal Street, Mumbai – 400 001

Security Code: 531540

Dear Sir/Madam

## Sub: Submission of Copies of Newspaper Advertisement of the Notice of 29th AGM

Please find enclosed herewith copies of the newspaper advertisement published in Free Press Gujarat (English edition) and Lokmitra (Gujarati edition) on 07<sup>th</sup> September, 2023, in compliance with the provision of the Companies Act, 2013 and SEBI (LODR) Regulations 2015 in relation to the 29<sup>th</sup> Annual General Meeting of the Company.

You are requested to please take the same on record.

Thanking you,

Yours faithfully, *For*, **Maruti Infrastructure Limited** 

Alfez Solanki Company Secretary & Compliance Officer

Encl: As above

\_

## 71 stolen mobile phones recovered from two thieves Unit-3 at Kakrapar attains full capacity

Ahmedabad : City while they were on their police, based on way to sell 57 stolen information, nabbed two mobile phones to a gang mobile phone snatchers who buys these gadgets

### SHUKRA JEWELLERY LIMITED

CIN NO. L52393GJ1991PL079516

Reg. Office: PANCHDHARA COMPLEX 3° FLOOR NEAR THE GRAND BHAGA
HOTEL S.G. HIGHWAY BODAKDEV AHMEDABAD Ahmedabad GJ 380054

Email: shukrajewellen/@yahoo.co.in
NOTICE

Email: shukrajewelley@phono.co. 19.

Notice is hereby given that 32 "Amust General Meeting of SHUKRA JEWELLERY LIMITED will be held on Salurday, September 30", 2023 at 0.400 P.M. ST at 19.

NOTICE SHOWNERS "FLOOR NEAR THE GRANDHACAWATH DITEL S.G. HIGHWAY BODANCE NAMEDIABAD G.S. 380,061 ht to transact the businesses as NAMEDIABAD G.S. 380,061 ht to transact the businesses and the second secon

TQ:09 2023.

Notice is further given pursuant to section 91 of the Companies Act, 2013 and Regulation 42 of the LODR, 2015 that the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from Saturary, Segtember 2, 2023 to Saturaly, September 3, 2023 to Saturaly, September 30, 2023 (both days inclusive) for the purpose of ensuing 32" Annual General Meeting of

the company. Asper the Section 108 of the Companies Act, 2013 read with the Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, the company has provided its shareholders the facility to cast their vote by electronic means (E-voting) on all the resolution set forth in the notice. The details are required pursuant to the provision of the

Co	mpanies Act, 2013 and rules are given und	er:
1	mpanies Act, 2013 and rules are given und Date of completion of sending of Notices	05.09.202

2 Date & Time of commencement of voting Wednesday, 27th September, 2023 at 105.00 p. 2023

2 Date & Time of commencement of voting Wednesday, 27th September, 2023 at 105.00 p. 2015 p

not be allowed beyond. IST

5 The Notice of 32" AGM is available on www.shukrajeweillery.com
Company's website &n nNSDL website
www.evoling.nsdl.com
www.besindia.com
controller.nept of Europian
Saturday, 23" September, 2023

ititiement of E-voting,
mandat details of person responsible to CHANDRAKANT HIMMATLAL SHAH,
dress the grievances connected with DIRECTOR
selectronic voting and meeting through
CIOAVM;
FIGOR NEAR THE GRAND BHAGAWATI
HOTEL S.G. HIGHWY S DOAMSEV
AHMEDABAD Ahmedabad GJ 380054 IN

Eacilly for voting through ballot paper shall not be made available at the AGM and the membrish have not cast their vote through remote e-voting shall be able to vote at the AGM. Members who have cast their vote through remote e-voting prior to the AGM may atte

Members who have cast their vote through remote e-voting prior to the AGM may attend the AGM to shall be not entitled to cast their vote again. Any person who becomes a member of the Company after dispatch of the Notice of the Meeting and holding shares as on the cut-off date is Saturday, 23° September, 2023 may obtain user ID and password by sending a request at evoling@rest.co.in Any person whose annea is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on cut off date is. Saturday, 23° September, 220° any shall be entitled to avail the facility of remote e-voting as well as voling in general meeting.

For. SHUKRA JEWELERY LIMITED

For. SHUKRA JEWELERY LIMITED

For SHUKRA JEWELLERY LIMITED

Sd/ CHANDRAKANT HIMMATLAL SHAF Director (DIN: 01188001)

without bills. After the two were apprehended, they divulged that they had also sold off 10 phones couple sold off 10 phones couple of days ago. Chasing this information, police caught a woman who dealt in stolen phones and recovered 14 phones from her.

The 71 stolen phones

The 71 stolen phones have been valued at Rs 4.72 lakh and with that cops could also solve seven cases of phone snatching. Talking to media, DCP Zone-2 Bhagirath Gadhvi said that two persons, who roamed



### TITAANIUM TEN ENTERPRISE LIMITED

CIN: L52100GI2008PLC055075

Regd. Office: Shop No. 901/914, 9th Floor, Rajhans Complex,Ring
Road, Surat - 395002, GJ Phone: 0261-2320240,
email:complianceOltitaanium@gmail.com,
website:www.titaaniummle.co.in

website; www.titaaniumten.co.in

NOTICE OF THE 15TH ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND REMOTE E-VOTING INFORMATION to ice is hereby given that the 15th Annual General Meeting (\*AGM\*) of the Mentanian The Emergency Lainited (\*Company) will be held of Saunday, tember, 2023 at 1100 a.m.at the Registered Offices of the Company situate to the 15th Floor, Rajilana Complex, Ring Road, Saurd - 95 and to transact the business, mentioned in the Notice of the Meeting sent along the Company situate of the Company situate to the Company situate to the Company situate of the Meeting sent along the Company of the Company and Administration of the Meeting sent along and to transact the business. Therefore, Rajilana Company and Andrees Meeting sent along the Administration of the Meeting sent along the Sent along the Meeting Sent along the Meeting Sent along the Meeting Sent along the Sent along the Meeting Sent along the Meeting Sent along the Sent along the Meeting Sent along the Sent along the Meeting Sent along the Sent along the Sent along the Sent along the Meeting Sent along the Sent along

Depository Participants/company, the Power of the said docum website of the Company www.trianutimen.co.in and copies of the said docum also available for inspection at the Registered Office of the Company betwee a.m. to 01:00 p.m. on all working days except on holidays, up to and included adde of AGM of the Company. Notice is further given that pursuant to pro-Section 91 of the Companies Act, 2013 read with applicable Rules and Regul of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 the Register of Members and Share Transfer Books of the Company will remain the Register of Members and Share Transfer Books of the Company will remain closed from 23rd September, 2023 to 30th September, 2023 (both days inclusive). Notice is further given that pursuant to Section 108 of the Companies Act, 2013, Radio 44 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation, 2014 to 44 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation, 2013 to 44 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation, 2014 to 45 or 65 or 65

2023 at 09:00 a.m. and ends on Friday, 29th September, 2023 at 05:00 p.m. The evoting module shall be disabled for voting thereafter.

ing moutine stant to custained not voring interestent?

The voting rights of the members shall be in proportion to the equi method by them in the paid-up equity share capital of the Company as on Frida and September, 2025 (cut-off date). The Members who have cast their votes by remote e-voting prior to the Man and the standard participate in the AGM but shall not be entitled to cast the way also attend participate in the AGM but shall not be entitled to cast the standard participate in the AGM but shall not be entitled to cast the standard participate in the AGM but shall not be entitled to cast the standard participate in the AGM but shall not be entitled to cast the standard participate in the AGM but shall not be entitled to cast the standard participate in the AGM but shall not be entitled to cast the standard participate in the AGM but shall not be entitled to cast the standard participate in the AGM but shall not be entitled to cast the standard participate in the AGM but shall not be entitled to cast the standard participate in the AGM but shall not be entitled to cast the standard participate in the AGM but shall not be entitled to cast the standard participate in the AGM but shall not be entitled to cast the standard participate in the AGM but shall not be entitled to cast the standard participate in the AGM but shall not be entitled to cast the standard participate in the AGM but shall not be entitled to standard participate in the AGM but shall not be entitled to standard participate in the AGM but shall not be entitled to standard participate in the AGM but shall not be entitled to shall not be entitled to standard participate in the AGM but shall not be entitled to shall not be e

votes on the Resolutions through remote e-voting and are otherwise not harmed frod doing so, shall be eligible to vote through ballet paper during the AGM.

e. Any person, who acquires Equity Sharse of the Company and become a Amberte afred signach of Notice and holding Shares so of the Friday, 22nd Septer ber, 2023 may obtain the login 1d and password by sending a request sevening@malc.not.

In case of any queries or issues, you may refer the Frequently Asked Question (FAGN) for Shardolders and evolving near manual for Shardolders at the devolved section of www.evoing.notl.com or call ont oil—free no. 1800-1020-990 or 1800 2 44 30 or end a request at evolvine@malc.oin.



could not locate them as the phones were already sold off. But we found another women with 14 more mobiles. We seized all the 14 mobiles under CrPc 102 and will check if these were also snatched. If they turn

out to be stolen phones we

will arrest the woman if she is involved."

WESTERN RAILWAY

Auction sale program to be held PRTN Depot is re-scheduled for 25.09.2023 to 22.09.2023. All otherms and conditions will remain unchanged, Please visit Wester Railway Website of materia was newww.rindianrailways.gov.in as we as on www.rindianrailways.gov.in as we son www.rindianrailways.gov.in as we consulty of the truther information.

(No. S/SIII/AuctionProgramme-2/SEPTEMBER 2023 Dated

Surat: It was celebration time for scientists, engineers and technical staff at the site of Kakrapar Atomic Power Station (KAPS) as the 700 MWe Unit 3 – India's biggest nuclear power plant unit built indigenously — started operation at full capacity on Wednesday. The celebration continued on Thursday as Prime Minister Narendra Modi applauded the achievement. on their moped and snatched mobiles phones from unsuspecting public. Cops nabbed Mehul Gohil and Jitu Sonkar on their moped while they were heading to Santoshinagar near Bhimnagar railway underpass to meet a buyer. On checking, police found six mobiles with them and another 51 kept in storage of the moped." Dindoli police sub inspector Harpal Masani told TOI: "During investigation, it was revealed that they sold 10 mobiles to two women buyers in Karanjwad area two days ago. Based on details, we raided the place to find the women but could not locate them as the phones were already sold the state of the state

Prime Minister Narendra Modi applauded the achievement. The PM tweeted, 'India achieves another milestone. The first largest indigenous 700 MWe Kakrapar Nuclear Power Plant Unit-3 in Gujarat starts operations at full capacity. Congratulations to our scientists and engineers.' Union home minister Amt Shah also congratulated KAPS personnel. 'India's power acquires a new dimension today as our largest indigenous 700 MWe Kakrapar Nuclear Power Plant Unit-3 in

Nuclear Power Plant Unit-3 in Gujarat starts operation at full capacity. It is a firm step towards attaining PM@narendramodi Ji's vision towards attaining PM@narendramodi Ji's vision of self-sufficiency in power production. My heartfelt congratulations to the congratulations to the scientists and engineers involved in the project," Shah in a statement, "The plant is supplying electricity to Gujarat and other adjacent states through national grid. It is a historic moment in India's domestic civilian nuclear programme. It also demonstrates our scientific and technical capability of this high-end technology." production," said the

statement.

"The achievement of full capacity production in Unit-3 is a significant milestone for Kakrapar site and reaffirms its commitment to providing safe, reliable, and sustainable power to the nation. As a key player in India's energy sector, the Kakrapar station plays a crucial role in meeting the growing demand for electricity and reducing the country's carbon footprint," it further stated.

Kakrapar site director Sunil Kumar Roy said, "We are proud to announce the successful attainment of 700 MWe full power capacity production at Unit-3. This achievement demonstrates our commitment to meeting the nation's energy needs and reducing our dependence on fossil fuels. We are grateful to our highly skilled employees for their unwavering "The achievement of full KAPS is a nuclear power plant located in Mandvi taluka of Surat district. It is operated by the Nuclear Power Corporation of India Limited (NPCIL). The Kakrapar site comprises four pressurized heavy water reactors (PHWR) of which two are of 220 MWe and two of 700 MWe each.

"The 700 MWe Unit-3 and Unit-4 are the India's biggest indigenously

and Unit-4 are the India's our highly skilled employees biggest indigenously our highly skilled employees several modern safety edeciation to ensuring the safe features. The station has been meticulously designed and equipped with state-of-the-art stechnology to ensure efficient and uninterrupted electricity stakeholders."

# City to get 100 electric

buses under eBus Sewa Vadodara: The Vadodara Municipal Sources said that besidest the valodara Municipal Sources with Committee of the Vadodara valodara valo

## **SACHETA METALS LIMITED**

CIN: L27100GJ1990PLC013784

Registered Office: Block No. 33, Sacheta Udyog Nagar, Village-Mahiyal, Tal. Talod, Dist.-Sabarkantha-383215, Gujarat., Ph. No.: +91 - 02770- 221739/ 221239

E-mail: sacheta@sacheta.com

## NOTICE OF THE 33rd ANNUAL GENERAL MEETING, E-VOTING AND BOOK CLOSURE

NOTICE OF THE 33rd ANNUAL GENERAL MEETING, E-VOTING AND BOOK CLOSURE
Annual General Meeting:

NOTICE is hereby given that the 33rd Annual General Meeting (AGM' or 'Meeting') of the Members of Sacheta Media
Initiad (the Company) will be held on Saturday, September 30, 2023 at 11.00 a.m. (IST) at the registered office of the
Company to transact the business as set out in the Notice of the AGM.

In compliance with SEBI Circular No. SEBINO/CEP/DDP/CIRP/P2022/SE, dated May 13, 2022, the Company had
electronic mode only to those Members whose e-mail addresses are registered with the Company or Registrar 8
Transfer Agent and Depositories.

The requirement of sending physical copies of the Notice of the AGM has been dispersed with vide MCA Circulars and
the SEBI Circular. The Annual Report 2022-23 of the Company, inter alia, containing the Notice and the Explanal
Satement of the 37d AGM is available on the website of the Company at vow.schorlac.com and on the website of the
Depository Limited (\*NSDL') at www.evolrign.nsdl.com.

Remote e-Voting:

Remote e-Veting:

In compliance with Section 108 of the Companies Act, 2013 ('the Act') read with Rule 20 of the Companies (Ma. and Administration) Rules, 2014, as amended from time to time, the Secretarial Standard on General Meetin issued by the Institute of Company Secretarials of India and Regulation 44 of the SEBI (Listing Obliga) Disclosure Requirements) Regulations, 2015, the Company is providing to its Members the facility of remote before the AGM in respect of the business to be transacted at the AGM and for this purpose, the Company is provided to the AGM and for this purpose, the Company is provided to the AGM and for the purpose, the Company is provided to the AGM and for the purpose, the Company is provided to the AGM. Members are requested to following:

The remote e-Voting facility would be available during the following period:
The evoting period commences on Wednesday, 27th September 2023 (10:00 a.m. IST) and ends
September 2023 (5:00 p.m. IST). The remote e-Voting module shall be disabled by NSDL for voting thereafter and Members will not be allowed to vote electronically beyond the said date and time;

Place: Mumbai Date : 5th September, 2023

sequentier aux3 (3:00 p.m. LS1).

The remote eviding module sable deliashled by NSDL for voting thereafter and Members will not be allowed to vote electronically beyond the said date and time; vote electronically beyond the said date and time; vote electronically beyond the said date and time; vote electronically electr

For Sacheta Metals Limited

ST/-Satishkumar Shah Keshavlal

## MARUTI INFRASTRUCTURE LIMITED

### NOTICE OF 29TH ANNUAL GENERAL MEETING

NOTICE OF 29TH ANNUAL GENERAL MEETING

Notice is hereby given that the 29th Annual General Meeting ("AGM") of the members of the Company will be held through Veloc Conferencing or Other Audio Visual Meens ("VC(DAM") on Saturday, 30th September, 2023 at 1145 a.m., incomplance with the applicable provisions of the Companies Act, 1145 a.m., incomplance with the applicable provisions of the Companies Act, read with MCA Croular no. 14/2020 dated 8th April, 2020, Circular no. 12/2020 dated 13th April, 2020, Circular no. 12/2020 dated 13th April, 2020, Circular no. 20/2020 dated 13th April, 2020, Circular no. 20/2020 dated 13th April, 2020, Circular no. 20/2020 dated 13th April, 2020, Circular no. 20/2021 dated 13th April, 2021, Circular no. 25th April, 2021, Circular no. 25th

peticipate in the ACM through VC/OAVM only.

In accordance with the MCA circulars and SEBI circulars, the Notice of ACM alongwith the Annual Report of the Company for the financial year ended on 13th Annual Report of the Company for the financial year ended on 13th Annual Report as the sense next through enail on 6th September, 2023 to all members whose email addresses are registered with the Company/Depository Participate whose whose whose which are also available on the website of the Company at www.martitifria. In all Report is also available on the website of the SED Limited at www.beendlac.com. The Notice of AGM is also available on the website of the SED Limited at www.beendlac.com. The Notice of AGM is also available on the website of the SED Limited at www.beendlac.com.

www.evoling.nsdl.com
In compliance with the provision of Section 108 of the Companies Act 20.13 read
with Rule 20 of the Companies (Management and Administration) Rules 2014 as
amended from time to time and Regulation 44 of SERIL(Isting Obligation)
Discourse Requirements) Regulations, 2013 and Secretarial Standard on General
Discourse Requirements (Pegulations, 2013 and Secretarial Standard on General
Redings issued by the Institute of Company Secretarial Standard on General
(a)
(a)
(b) Red Montage (Company Secretarial Standard on General
Redings (Company Secretarial Standard on General
(b)
(c) The remote evoling will commerce from Wednesday, 27th, September,
2023 at 09:00 any;

resolutions set out in the woode of the 25th Alexy, 27th, September, The emotie e-volting will commence from 'Wednesday, 27th, September, The remote e-volting will end on Friday, 28th, September, 2023 at 0.5:00 pm; Cut off date: Schirturd, 20d September, 2023; In case any person who becomes a Member of the Company after the dispatch of ASM Notice and Annual Report and noish shares as on the cutoff date is 2.25 September, 2023, may write to company on the email of martial, Infra@yaho.com requesting for the User I day and second for e-volting;

mbers are requested to note that: note e-voting shall not be allowed after 5.00 pm on Friday, 29th stember, 2023:

service e-voting shall not be allowed after 5-out pm of minsaly, 24th September, 2023.

Will be attending the AGM through NC or OAMM and have not cast their vote on the resolutions through remote e-voting shall be able to exercise their voting right during the AGM. The Bofflity for e-voting shall be made available through e-voting system during the AGM; The members who have already cast their vote through remote e-voting may attend the meeting through NC or OAMM but shall not be entitled to cast their vote again through the e-voting system available during the AGM;

Whenthes holding shares are on the cut off state i.e. Saturday, 23dr Nembers 10 of the state of the saturday.

Members holding shares as on the cut off date i.e. Saturday, 23rd September, 2023, shall only be entitled to avail the facility of remote e voting or e-voting system at the 29th AGM;

voling or e-voting system at the 29th AGF.

If you have any queries or issuer regarding attending AGN 8 e-Voting from the NSDL e-Voting System, you can call on: 0.22 -4896 7000 and 0.22 -2499 7000 or an order or expect as the evoting Breat leaves of the evolung Breat leaves or a request at evoting Breat leaves or a request at the evoting Breat leaves or a result of the evoting Breat leaves or a result o

, 2023 Alfez Solanki Company Secretary & Compliance Officer Regd. Office: 802, Surmount, Opp. Reliance Mart, Iscon Cross Road, S G. Highway, Ahmedabad, Gujarat-380015, India. Ph.: 079-40093482 E-mail:maruti\_infra@yalno.com, Website: www.marutlinfra.ir CIN: L45100G11994PLC023742

# Three arrested for looting Tett railway employee of 12L Ahmedabad: The local crime branch (LCB) of the Vadodara rural police arrested by Vadodara rural police arrested

Ahmedabad: The local crime branch (LCB) of the Vadodara rural police arrested three persons who had looted 12.07 lakh from a 57-year-old man, who had withdrawn the cash from banks, on Padra Road on the city's outskirts on April 8. The victim Jaikshan Lokwani (57), a retired railway employee, had collected the money for a payments bank.

## WESTERN RAILWAY

Divisional Railway Manager (WA) Western Railway, 6th floor, Engg Deptt., Mumbai Central, Mumbai - 40 008. invites E-tender Notice No BCT/23-24/172 dtd.05.09.2023 008. invites Extender Notice No: ECT/23-24-172 etd.05.09.2023. Work and location: Joravasan-box in liqu of Masony arch bridge at various location under DeNiCentral (Composite Tender) (Two Pocket System). Approx. cost of .work Rs. 1231700.00. Date & Timor of Submission: on 06.10.2023 till 15.00 hrs. Regarding detailed nature document (from relatedish). EMG document (from relatedish). EMG document (from relatedish). EMG detailed tender conditions, please visit www.irsps.gov/in. Manual offers will www.irsps.gov/in. Manual offers will not be considered.

totalling Rs 12.07 lakh from totalling RS 12.07 lakin from two banks, and was riding on his scooter on the service road of Padra highway. Three men, who were approximately 32 to 35 years old, were walking in the middle of the service road ahead of him. Lokwani slowed drown and horsded, but inchead

Road police station in the city on April 8. n Friday night, LCB sleuths were patrolling the Vadu area in Padra and gathering information regarding people involved in property offences earlier. They were tipped off that Jignesh Parmar, a resident of Vadu who was involved in nine drown on in in Diwiked, but inside offences, had committed loot. The offence is a committed loot. The committed loot offences had committed loot. The committed loot of the scooper's handle and committed loot. The committed loot of the scooper's handle and caught them.

## 663 seats vacant after second round of MBBS, BDS intake

Ahmedabad: The Admission Committee for Professional Undergraduate Medical Educational Courses (ACPUGMEC) on Tuesday announced that at the end of the second round of Tuesday announced that at the end of the second round of admissions to undergraduate medical and dental courses, 663 seats are vacant. The committee said that 6,336 students have confirmed their admissions to the MBBS course which has 6,573 seats, leaving 237 seats vacant. 663 seats vacant after second round of MBBS, BDS intake in the BDS course, the committee allotted 1,119 seats to students and 693 of them confirmed their admissions by paying tuition fees. The remaining 426 seats are vacant due to non-reporting. The committee's statement said that the security deposits of the 663 students, who have not confirmed their admissions, have been forfeited and if they wish to participate in the further rounds of admission.

## PHYSICAL POSSESSION NOTICE

Branch Office: ICICI Bank Ltd., Office Number 201-B, 2nd Floor, Road No 1 Plot No-B3, WIFI IT Park, Wagle Industrial Estate, Thane, Maharashtra- 400604

Whereas
The undersigned being the Authorized Officer of ICICI Bank Limited under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under section 13 (12) RW Rule 3 of the Security Interest (Enforcement) rules 2002. Issued demand notices upon the borrowers mentioned below, (on underlying pool assigned to ICICI Bank by Dewan Housing Finance LId, in relation to the enforcement of Security in respect of a housing loan facility granted the sing Finance LId, in relation to the enforcement of Security in respect of a housing loan facility granted the underlying the security of Sec

& ICIĆI New LAN)		Notice (Rs.)	
ohai Solanki/ Jashuben Harkhabhai - QZBRD00005011939 (Old DHFL	Block No. 699,Krishna City, Dabhoi Ring Road, Nr Kelanpur Vadodara-Gujarat, Vadodara- 391100- September 03, 2023.	June 18, 2021/ Rs. 12,07,321.00/-	Vadodara
	- QZBRD00005011939 (Old DHFL t No. 1800007047)	phai Solanki/ Jashuben Harkhabhai Dabhoi Ring Road, Nr Kelanpur Vadodara-Gujarat, Vadodara- t No. 1800007047) DHFL 391100- September 03, 2023.	ohai Solanki/ Jashuben Harkhabhai Dabhoi Ring Road, Nr Kelanpur Rs QZBRD00005011939 (Old DHFL Vadodara-Gujarat, Vadodara- 12,07,321.00/-

rive anover-mentioned borrowers(s) guarantors(s) are hereby given a 30 day notice to repay the amount, else the mortgaged properties will be sold on the expiry of 30 days from the date of publication of this Notice, as per the provisions under the Rules 8 and 9 of Security Interest (Enforcement) Rules 2002.

Date: September 67, 2023

Place: Vadodate.

## રાજકોટમાં વોશિંગ સોડામાંથી બનાવામાં આવતું હતું ફરસાણ

રાજકોટ રગીલુ રાજકોટ ખાશીપીથી દાઝીયું તેલ પણ મળી આવ્યું હતું. આદીંની આરોપીથી કાઝીયું તેલ પણ મળી આવ્યું હતું. આદીની આરોપીથી માટે પ્રખ્યાત છે. અહીંની આરોપીથી માટે લોકો ફરફરથી વખાણ સાંભળીને આવે છે. પરંતું ૫૫૦૦ કિલો અખાલ જથ્થો ફડ રાજકોટમાં કેવું ફડ પીરસાંઇ રહ્યું વિભાગે સ્થળ પર જ નાશ કર્યો છે તે જાળીને તેમને પણ આંચલે હતો તેમજ શીરામ અઢ દેશોગ વખાણ સાંભળીને આવે છે. પરંતું રાજકોટમાં કેવુ ફૂડ પીરસાઈ રહ્યુ છે તે જાણીને તેમને પણ આંચકો લાગશે. રાજકોટમાં મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થો પકડાયો છે. શ્રી રામ ગૃહ ઉદ્યોગમાંથી અખાદ્ય જથ્થો ગૃહ ઉઘાગમાવા અખાવ જિલ્લા મળી આવ્યો છે. ફરસાણ બનાવવામાં વોશિંગ સોડાનો ઉપયોગ થતો હતો. આરોગ્ય વિભાગ દ્વારા ૮૫૦ કિલો અખાદ્ય ફરસાણ જપ્ત કરાયું છે. તો ૨૦૦ કિસો શિખંડ, ૧૬૦ કિલો મીઠાઈ જપ્ત કરાઈ છે. કુલ ૫૫૦૦ કિલો અખાઘ જથ્થાનો નાશ કરાયો છે.

અખાય જથ્થાના નાશ કરાવા છે. રાજકો ટેના લક્ષ્મીનગર મેઈન રોડ પર આવેલા શ્રી રામ ગૃહ ઉદ્યોગ આવેલું છે. હાલ તહેવારોની મોસમ હોઈ અને ઉપવાસનો માહોલ હોઈ આરોગ્ય વિભાગ એક્ટિવ થયું છે. જેથી અારોગ્ય વિભાગ દ્વારા શ્રીરામ ગૃહ ઉદ્યોગમાં રેડ પાડવામાં આવી હતી. અહીંથી મોટા પ્રમાણમાં

અખાદ્ય જથ્થો ઝડપાયો હતો. આ ઉપરાતં વોશિંગ સોડાનો ઉપયોગ કરીને લોકોના જીવ જોખમમાં

હતો. તેમજ શ્રીરામ ગૃહ ઉદ્યોગ ચલાવતી પેઢીને નોટિસ પણ ફટકારાઈ છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં શ્રાવણ માસને લઈને આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફરાળી વાનગીઓમાં

ફરાળી વાનગીઓમાં વેપારીઓ ભેળસેળ કરતા હોવાની ફરિયાદના પગલે આરોગ્ય વિભાગની ટીમે અલગ-અલગ પાંચ ડેરીઓમાં દરોડા પાડ્યા હતા. આરોગ્ય વિભાગની ટીમની તપાસમાં ફરાળી પેટીસમાં ભેળસેળ કરવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે. હજી તાજેતરમાં જ જય સીયારામ ડેરી, ખુશ્ભુ ગાંઠિયા, ભગવતી ફરસાણમાંથી ૧૭૮ કિલો ભગવતા કરસાલાનાથા ૧૭૮ છેલા ઇટીસનો નાશ કરાયો હતો. લોટ સહિતની ચીજ વસ્તુમાં પણ ભેળસેળ કરાતી હોવાનું ધ્યાને આવતા નમુના લઈ નોટિસ કટકારવામાં આવી હતી. કરસાણ બનાવવામાં વોશિંગ સોડાનો ઉપયોગ થતો હતો. આરોગ્ય વિભાગ દારા ૮૫૦ કિલો કરાય લાકાયા હવે જ વનમાં આરાગ્યા (વભાગ ફારા ૮૫૦ હિલા મુકાતા હોવા પુષ્ત સામે આવ્યું છે. રેડમાં ૮૫૦ કિલો વાસી કરસાણ, ૨૦૦ કિલો શિખંડ, ૧૬૦ કિલો અખાઘ શિખંડ ૨૦૦ કિલો, ૧૬૦ મીઠાઈ જપ્ત કરાઈ છે.

## ગુજરાત સાયન્સ સિટી દ્વારા આયોજિત ક્વિઝ કોમ્પિટિશનમાં ૧૦ હજાર થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો નવાર વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન ગુજરાત



કાયકમાનું આવાજન ગુજરાત સાયન્સ સિટી દ્વારા કરવામાં આવતું રહે છે. ત્યારે સમગ્ર રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં ગુજરાત સાયન્સ સિટી દ્વારા ધોરણ દના વિદ્યાર્થીઓ માટે ભવ્ય ક્વિઝ ા વધાયાં માટ ભવ્ય ક્વઝ કોમ્પિટિશન અને ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૦૦થી વધુ શાળાઓના ૧૦ હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આગામી થોડા દિવસોમાં ગુજરાત

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી લોકો અને વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે અભિરુચિ વધે તેના માટે સતત સાયન્સ સિટી દ્વારા ધોરણ વિદ્યાર્થીઓ માટે પણ આવી ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં પ્રયત્નશીલ છે અને તેના માટે અવાર આવશે. -

## ટાઈટેનિયમ ટેન એન્ટરપ્રાઇજ લીમીટેડ

(CIN:L52100G12008PLC055075)

રજીસ્ટર્ડ ઓફિસ: શોપ નં. ૯૦૧/૯૧૪, રાજહંસ કોમ્પલેક્ષ, ૯મો માળ, રીંગ રોડ, સુરત- ૩૯૫૦૦૨, ગુજરાત ્ફોન: ૦૨૬૧- ૨૩૨૦૨૪૦ ઈમેલ:compliance01titaanium@gmail.com વેબસાઇટ: www.titaaniumten.co.ir

કંપનીની ૧૫મી વાર્ષિક સામાન્ય સભા, બુકકલોઝર અને ઈ-વોરિંગની માહિતી અંગેની નોટીસ આપી અને નોટિલ પાહલવામાં અલે છે કે, ટાઇટિંગલય દેન એન્ટલાઇક શિપિટેક ઇપનીના સભ્યોની ૧૫મી વાર્ષિક સામાન્ય આપ (AOM) શિવાના ડાંગની સ્ટેપ્યન, ડાંગનો સંજ સારે ૧૧-૦૦ વાર્યને શોય ને, ૯૦૧/૯૧૪, ટાઇટર્સ કંપ્યોક્કા, નાર્યો મળ, દિવ રોડ, સુતન-૩૯૫૦૦, સુજદાત અને કંપની નીજિટ લીક્સ ખાને અલેક્સ કંપની નોટિસમાં જાવાલીએ કાયકારને સલાવ્યા માં મળનાર છે, મોકલાયેલી નોટિસમાં સ્પષ્ટલા વિશેદન, રિકેસ્ટરનો અહેવાલ, ઓર્ડિટનો નહેવાલ તથા તા

પણ મોકલામાં આવ્યાં છે. વર્ષીક અનેલાક ભુવાવતા તા. વર્ષેખ્ય, ૨૦૦૩ માં રોજ જે રાખોમાં નામો કંપનીના રંજિક્ટરમાં કુકવાર, ૧૭ માર્ચમ્ય, ૨૦૨૩ સુધીમાં નોંધપોલા છે તમા છે સામમાં છે. નેપીલ માઇડી રોખના વિદેશોદીની વારોદાદ પાસેકંપમીમાં નોંધપોલા છે તે તમે નિર્ધાલ દાવા મોકાદી દાવા છે. અમ્મેનાનો નીટિક પોર્ટની વેશકાઇટ પાસેકંપપીમાં નોંધપોલા છે તે તમે નિર્ધાલ દાવા મોકાદી દાવા છે. અમેનાની નીટિક નીટની નોંધ પાસેકંપોની વેશકાઇટ પાસેકંપાલી માંધપાલ છે. તે તમે નેપાની અમેનાને તાલા વારો કર્યું કર્યું કર્યું કર્યા તે વારો આ ધોનાની પ્રીક્ટરી સીક્રિયાલ કાયાલ પાસે હતા કર્યા પાસેકંપાલ હતા કર્યા છે. છે. તમે કરીના નોંધપોલના ૧, પાસોકંપોલા ક્લાય ક્લાયલ પાસેક પાસેકંપોલી વારો કર્યા હતા કર્યા કર્યા છે. ૧.૦ ડાવામાં સુધી ઉપલોધ આ લોકો

રેજિલ્ટર્ડ બેલિકમાં કાયકારના તમામ દિલ્લો દરમિયાન, રજાલો વિવાય સવારના ૧૦,૦૦0ી ભારેવના ૧,૦૦૦ વાગ સુધી ઉપલખ છે, તેમાં દર્માના એકઅપેના તીરાં પર વામાંથ્ય પાયો છે. વિશેષમાં તેમાં તેમાં અને કર્યા કરે કર્યા કર્યા કર્યા કર્યા કરે કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કરે કર્યા કરે કર્યા કર્ય કર્યા કર્ય કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કર્ય કર્યા કર્ય કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કર્ય કર્યા કર્યા કર્યા કર્યા કર્ય કર્યા કર્યા કર્યા કર્ય કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કર્ય કર્યા કર્ય કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કર્ય કર્યા કર્યા કર્ય કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કર્ય કર્યા કર્ય કર્યા કર્યા કર્ય કર્યા કર્ય કર્યા કર્યા કર્યા કર્ય કર્યા કર

ટાઈટેનિયમ ટેન એન્ટરપ્રાઈઝ લીમીટેડ વતી અડી:-

Printed and Published by MAYUR C. BHATT on behat-A71977

Publiant Committed at Printed at: Dharti Printers C-3, Shankar Chember, Nr. Fadia Chamber, Asharam Road, Ahmedabad-Published From KatVARI PUBLIATION PVI. LTD. 201,202,208 Manda complex, opp mithakhali riy crossing, mithakhali, ahmedabad. Editor: Mayur C. Bhatt.

### ટેલરમેડ રિન્થએબલ્સ લિમીટેડ

CIN- L29307GJ2010PLC061759 -Mail : cs@tss-india.com, Contact : 079-40040

Oarir Tradelink Ud

ઓએસિસ ટેડલિંક લિમિટેડ

૨૭મી વાર્ષિક સામાન્ય સભા, ઇ-વોટિંગ માહિતી અને બુક ક્લોઝર અંગે નોટિસ

સહીં મીએ રામચંદ્ર દલ્લારામ ચૌધરી પતાવટ કરનાર IBBI/IPA-001/IP-P00157/2017-2018/103: AFA ૧૫-૧૧-૨૦૩ અધી ખાન



## STERLING GREENWOODS LIMITED

CIN:- L51100GJ1992PLC017646 Registered Office:- 25, Sunrise Centre, Drive-in-Cinema, Thaltej, Ahmedabad- 380054 lephone No:- 079 26851680,079 26850935

Opp. Drive-in-Cinema, Thaltej, Ahmedauour Opp. Drive-in-Cinema, Thaltej, Ahmedauour Opp. Drive-in-Cinema, Toleghone No:- 079 26851680,079 26850935 Website: www.sterlinggreenwoods.com

NOTICE OF THE 31st ANNUAL GENERAL MEETIN

The barehy given that the 31st Annual General Meeting (A. Opp. 1987) on Saturday

The barehy given that the 31st Annual General Meeting (A. Opp. 1987) on Saturday

NOTICE is hereby given that the 31st Annual General Meeting (AGM) whenbers of Sterling Greenwoods Limited will be held on Saturday, 308 September, 2023. at the Greenwood Lake Hollday Resort, Chharo Farm Complex, Off Sarkhej-Gandhinagar Highway, Opp. Village Chharo Ahmedabad at 11.30 a.m. to transact the business, as et out in th Notice dated An September 2023 convening the Annual General Meeting

ream complex. VI 3 an in-year bininger ingilway, Use, a visige Cul introholice dated 2nd September 2023 convening the Annual General Meeting.
The Company has sent the Notice of the 31st Annual General Meeting.
The Company has sent the Notice of the 31st Annual General Meeting
along with the Annual Report 2022-2023 on Wednesday, 6th September
2023 through electronic mode only to those Members whose e-mail
addresses are registered with the Company or Registera's Transfer Agent
and Depositories. The regularment of sending physical copies of the
SEBI Circular. The Annual Report 2022-2023 of Wednesday, 6th September
3023 through electronic and the Explanatory Statement of the 31st Annual
General Meeting is available on the website of the Company at
www.sterlinggreenwoods.com
Notice is also hereby given pursuant to the provisions of Section 19, of the
Company will remain closed from 2014 September, 2023 to days inclusive for the purpose of Annual General Meeting.
2023 both days inclusive for the purpose of Annual General Meeting.
Pursuant to the provisions of Section 108 of the Act and Rule 20 of the
Company will remain closed from 2014 September, 2023 to 30th September, 2023 and Regulation 4 of the Securities and Exchange Board of India (Listing
and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing
are provided with the facility to cast their vote electronically, through evoting facility provided by the Certail Depositors, Services (India) Limited
(CDSL) on all resolutions set forth in the Annual General Meeting notice.
The voting rights shall be in proprovion to the shares held by members as
on 23rd September, 2023, being the cut-off date.
The voting residity excluding period commence on Wednesday, 21th September
10 period of the Certail period of the Company of the Compa

on 23rd September, 2023, being the cut-off date. The remote e-voting period commence on Wednesday , 27th September 2023 at 9.00 a.m. and will end on Friday, 29th September 2023 at 9.00 a.m. and will end on Friday, 29th September, 2023 at 9.00 a.m. and will end on Friday, 29th September, 2023 at 9.00 are set the properties of the cut-off date in 23rd September, 2023, on cast their vote electronically in the manner and process set out or identification form, as on the cut-off date in 2.2rd September, 2023, on cast their vote electronically in the manner and process set out be disabled for voting thereafter. Once the vote on a resolution is cast by the member, the member will not be allowed to change it subsequently the member, the member will not be allowed to change it subsequently and the set of the subsequently and th

For, STERLING GREENWOODS LIMITED

Place: Ahmedabad Date: 6th September, 2023

Sd/-Bharatkumar Lekhi Managing Director (DIN: 03363339)

## ડાંગરની ખેતી કરતા ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા

નવસારી, નવસારીમાં હવે જગતનો છે. વરસાદ નહીં વરસતા ડાંગર અને તાત ફરી મુશ્કેલીમાં મુકાયો છે. શેરડીનો પાક બરબાદ થયો છે. પાણી ન વરસાદની હાથતાડીને કારણે પાક સુકાયો મળતા પાકમાં જીવાત પડી છે. સદલાવ



## મારૂતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ

૨૯ મી વાર્ષિક સામાન્ય સભા ની સૂચના

હરિયત ને. ૦.૬ (૩૦૧૧ લાઉપ ૧૩ થી માનુષાલી, ૨૦૦૧, પશ્ચિય ને ૦૩) રાગ્દર સાથિત પ્રથમી ને દેશ અને ભારત માને ક્લામાં ભારત કર્યું હતા કે માને કર્યા કર્યું હતા કર્યા કર્ય

કંપની સેક્રેટરી અને કંમ્પલાયંસ ઓફિસ

રજીસ્ટર્ડ ઓકિસ.૮૦૨, સરમાઈન્ટ, રીલાયન્સ માર્ટની સાયે, ઇસ્ક્રોન ચારરસ્તા, એસ.જી. લાઈવે, અમદાવાદ-૩૮૦ ૦૧૫ ૧૨:૦૭૯-૪૦૦૯૩૪૮૨ - ઈમેઇલ marrul, infra@yahoo.com વેષ: www.marulinl સીન: L45100GJ1994PLC023742

હવા એન્જીનિચર્સ લિમીટેડ

## CIN : L291206J1993PLC019199 રજીસ્ટર્ડ જોફિસ : પ્લોટ નં. ૧૨૯, કાશીરામ ટેક્સટાઈલ મિલ પાસે, ન અમદાવાદ, ગુજરાત - ૩૮૨૪૦પ. Email- cs@hawaengltd.

અપદાવાદ, ગુજરાત - ૩૮૧૪'ભ. Email- દર@hawaanght.com ૩૦મી વાર્વિક સામાન્ય સભાની સૂચના, સ્ત્રિમેટ ઇ-વોર્ટીંગ માહીતી, ૭૨ ઓફ અને ભુક હતો જ વવાની તારીઓ અહીં સૂચના આવમાં આવી છે કે હતા એન્જનિયસ રિયોર્ટિંગ તમ્યાંની ૩૦મી વાર્ષિક માન્ય સભા AGM શુક્રવાર ૨૯મી સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ સર્જિ ૭૪:૩૦ વાગ્યે વિકીયો સામાન્ય લખા AGM શુક્રવાર રહ્યી અરેમ્બર, 2023 ના ચોજ સોજે 07:30 વાગ્યે વિશેષ કોન્કરનિર્ચા (VC) અન્ય ઓર્ટિક ડિયાયુલલ મિન્સ (DAVM) આ કંપની અપિનિયન, 2013 તો નામા વધુ એ આવાઈએ અને તેમાં બંધાવી ત્યાં મારે આફ્રિકીટીઝ એન એક અર્ચવર્ય જ લોડે આ કે છે. તેમાં અર્ચા એ અર્ચા કે અર્ચા કર્યા કર્યા

રાખ્યો કારા નિરીકાલ માટે ઈલેક્ટ્રેફીન્ક કીને ઉપલબ્ધ છે. આવા દરતાયેલીની તપાસ કરવા માંગતા સખ્યો દરા@hawaengldt.comu ર ઈને બાંકહી શકે છે. આવી દુસ્તાયેલી પાસ કરવા માંગતા સખ્યો દરા@hawaengldt.comu ર ઈને બાંકહી શકે છે. આવી પૂત્રમાં એ પણ આપવામાં આવી છે કે કંપની એક્ટ, 2013 (સેક્ટ્રેક) ની કલમ ૯૧ ની લોગલાં અનુ કાર્ય કંપનીક હિન્મ કંપને છે. એક એક્ટ્રિમીસ્ટ્રેશન) નિયમો ૮ 2015, સભ્યોના સ્વરુષ્ટ્રસ્ત ૧૨ રહ્યા અંદ અન્ય દર્શ કર્યા આવેલા કંપની કહ્યા દર રથી સલ્ટેક્યન ૨૦૨૩ થી શુક્રવાર ૧૨૯થી, સર્ટેક્યન ૨૦૧૬ લીબે કિલ્સો સહિતો કંપનીની 30મી કંપનીની 10મી કંપને કંપની ક્લિયોની અધિયામાં ૨૦૨૩ કર્યા કંપના કંપન

રોજ કંપનીની પેઈડ અપ ઇકિંકલી કોર મુક્તિમાં તેમના લારા રાખવામાં આવેલા ઉકિકલી કોરના પ્રમાણમાં લો.
દીમો છે ત્વીટીંગ મંગળવાર, ર કમી સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ સવારે ૯૦૦ વાર પેશ રહ્યાં લે મુક્તિ મારે તેને સુરુવાર, રાત્મે સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ સાંજે પ.૦૦ વાર્ચ્ય સમાપ્ત થશે, આ સમયવાળા દરમીયાન, કર-ઓક તારીખ ભીતિક સ્વરૂપે શેર પરાવનાર કંપનીના સભ્યો એટલે કે શુક્રવાર, ૨૨મી સપ્ટેમ્બર, ૨૦૨૩ ઈકિક્ટ્રીનિક રીતે તેમનો મત આપી શકે છે. દીમો છે તેનીટેંગ માંડલુલ સીડીએસબેલ ફાર્સ પેશ્વેપ્ત માંડલુલ સીડીએસબેલ ફાર્સ પેશ્વેપ્ત માંડલુલ સીડીએસબેલ ફાર્સ પેશ્વેપ્ત માંડલુલ સીડીએસબેલ ફાર્સ પેશ્વેપ્ત માંડલુલ સીડીએસબેલ ફાર્સ પેશ્વેપની મત આપી ન લીપ અને અન્યાય તેમને આપા મત્ર કરવાથી માર્ગ છે. એ અને અપ્યાય તેમને આપા કરવાથી દ્વાર્તીનેલ કરવામાં આવશે ન હોંગ સ્વાય કર્યા સ્વાય છે. હોંટીંગ સિસ્ટમ્બ કારો સમ અપાય સાથે પ્રખ હશે.

પાટાળાલસ્તન પ્રાપ્ત તા બાપવા માટ પાત્ર હસ. જે સભ્યોએ એજીએમ પહેલાં રીમોટ ઈ-વોટીંગ દ્રારા તેમનો મત આપ્યો છે તેઓ પણ VC/ OAVM દ્રારા એજીએમમાં હાજરી / ભાગ લઈ શકશે પરંતુ તેઓ ફરીથી તેમનો મત આપવા માટે કેદાર રહેશે નહીં. કોઈપણ વ્યક્તિ, જે કંપનીના શેર હસ્તગત કરે છે અને કંપની દ્રારા નોટીસ ઈલેક્ટ્રોનિક રીતે

કોઈપણ વ્યક્તિ, જે કંપનીના શેર હાત્મજત કરે છે અને કંપની શરા નોટીલ ઈલેકટ્ટ્રીમિક કીઠ મોકલવામાં આવ્યા પણી ઈપનીમ લાગ્ય ભને છે અને કર-ગોત તમીરે ધરાયો છે તે તે વ્યક્તિ કેપ પાત્ર છે તે તે વેચ્છે કર્યા કરે છે. મોકળ કિલ્સ સ્થળાં તે આપ્યા કેપ કરો છે તે તે વેચ્છે કરે પાર્ટ અને ક્ષેત્ર કેપ પાત્ર અને કર્યા કરે તે હતી કર્યા કરે તે વાર્ટી અને પાસર લે તો પંપાયે કરી શકે છે. કે ખેતવી કરે હતી કરે માને કર્યા કરે છે. કેપ કરો હતી કર્યા કરે હતી કરે માને કર્યા કરે હતી કરે માને કર્યા કરે હતી કરે કર્યા કરે હતી કરે

પરેલ (ઈ), મુંબઈ - ૪૦૦૦૧૩, ઈમેલ : helpdesk.evoting@cdslindia.com પર સંપક

. એજીએમની વિગતો કંપનીની વેબસાઈટ : www.hawaengltd.com CDSL at ww.evotingindia.com. BSE Limited at www.bseindia.com પર ઉપલબ્ધ છે.

સલી/-, અસલમ કાગદી, (ચેરમેન) DIN: 00006879

ગામના ખેડૂતો મુખ્યત્વે ડાંગર અને ડાંગરની ખેતી કરતા ખેડૂતો પર ચિતાના શેરડીની ખેતી કરે છે. જુલાઈમાં વાદળો ઘેરાયા. ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિના કારક્ષે શેરડી અને અન્ય વરસાદ નહીં પડતા ડાંગર અને શેરડીના શરડાના ખતા કર છે. જુલાઇમાં વાદળા થરાવા. આંગસ્ટ માહનામાં અતિવૃષ્ટિના કારણે શેરડી અને અન્ય વરસાદ નહીં પડ્તા ગુંગર અને શેરડીના પાકને નુક્ક્ષાન થેશુંહતું. એવામાં ઓગસ્ટ પાકને ભારે નુક્ક્ષાન થઈ રહ્યું છે. ગુંગર મહિના બાદ વરસાદે હાથ તાડી આપી પકવવા માટે તૈયાર કરવામાં આવેલું પરું છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખેંચાતા સુક્રાઈ જવાના આરે છે.

## શ્રીરામ હાઉસિંગ ફાયાનાન્સ લીમીટેડ

SHRIR 🦝 M HOUSING FINANCE પ્રેચાર્ચમાં આફિસ ને લેવલના, લોક્સાર્ટ ટાવર્સ, ઇસ્ટ વિંગ, સી-૨, જી બ્લોક, માં ને જે ત્યાર માન્ય ક્રિયા સ્થિત સી-૨, જી બ્લોક, માન્ય ક્રિયા સ્થિત સી-૨, જી બ્લોક, માન્ય ક્રિયા સ્થિત સ્થાર્ચક માન્ય ક્રિયા સ્થિત સી-૨, જી બ્લોક, માન્ય ક્રિયા સ્થિત માન્ય ક્રિયા સ્થિત સ્થાર્ચક માન્ય ક્રિયા સ્થિત માન્ય ક્રિયા સ્થિત માન્ય ક્રિયા સ્થાર્ચક સ્થાર્ય સ્થાર્ચક સ્થાર્

૧. મનિશ ૨. વૈશાર્લ

સરનામું

બિલ્ડિંગ ઇન્ટરસિ

સામે, મગ સુરત-૩૯

નં.૧૦૧

બિલ્ડિંગ ປະຊາວໄລ່:

સાંકેતિક કબ્જા નોટીસ

ાદારોનું નામ મને સરનામું	માંગણા નોટિસ મુજબ લેણાં રકમ	મિલકતનું વિવરણ
પ્રકાશભાઈ બોઈ દીબેન મનિશ ભોઈ દ ક્લેટ નં. ૨૦૩, નં. ૧૮, પ્રિયંકા ટી, પુના પોલિસ દ્વાપતિ પાર્વેન પાર્ટિયા, ૧૫૦૧૦ સરના મું: ક્લેટ , પહેલો માળ, નં. ૨૪, પ્રિયંકા દી, ઇન્ડિયન પેટ્રોલ દ્વાપ્યું, બક્તિયામ પ્રામ, પુના પાર્ટિયા ૧૪ નક કાર્ડ કરા, દેવન કહેલ્લો સુરત- ૦૦	oc/or/2033 ના સંજ આગળના અન્ય સાર્જિસ, ખર્ચાઓ સાથે સ્થાપના ૧૦ કિંત્રસની અંદર રકમ લેવના માને ક્રિયાના સ્થાપના ૧૦ કિંત્રસની અંદર રકમ લેવના માનત સ્થાપના સંદર્ભમાં અદ્ભાર રકમ સામાનક્રમાં અભ્યાપના સંદર્ભમાં સ્થાપના સ્થાપન	કલેટ તે 1,00 માં મા તમામ હતી, માપલી દયો, માપલી દયો, માપલી દય, 33 રહે. મી, બિલ્ટ અપ તો છે. લ્લેટ કે. મી, સુપર નિલ્દ અપ, પ્રિયંક્રા ઇન્ટરસિટી, ના નિર્દિઇંગ તે - 37 ના હતી હતી. સુપર ના પહેલા માળ ઉપર સ્થિત, જમીન નિર્દિઇંગ તે - 37 ના હતી હતી. સુપર ને 1,37 હ ઉપર ને 1,57 હતી. સુપર ને 1,5

ઇન્ટરાસદા, ડાંગ્ય પંપની બાજુમાં, ભક્તિધામ મંદિર સામે, પુના પાટિયા પાસે, સુરત-કડોદરા રોડ, ગામ-મગોબ, સબજી.પુન (સિટી) જીલ્લો સુરત

૧.વિજયકુમાર બહાદુરભાઈ હલપતિ ૨) કપિલાબેન વિજયભાઈ SHLHSRAT 0000770 આગળના અન્ય ચાર્જિસ, ખર્ચાઓ સાથે નોટીસ મલ્યાના ૬૦ દિવસની અંદર રકમ

હલપતિ સરનામું: ૩૭, કાસા હોમ્સ, રોયલ રેસિડેન્સીની બાજુમાં, ગંગાધારા પોલિસ સ્ટેશન પાસે, સુરત બારડોલી રોડ, સોયાની, તા.પલસાના, જી. સુરત-૩૯૪૩૧૦ –

ાદવસના અંદર રકમ રૂા. ૩૨,૧૨,૮૯૯/-(રૂપિયા બત્રીસ લાખ, બાર હજાર, આઠસોને નવ્વાર્શું પુરા)

દાલિણ કલેટ ને.102 સ્થાયી મિલકતમાંના તમામ ભાગે અને પાસંલો, બેરિંગ ખાટે નં.30(કે.જે.પી. મુજબ ભાંક ને.1 જપાગ્રે), માપલી ૧૧૬-૦૦ રકે.મી., કાલા હોમ્સની એંદર પાંગ. જ સ્કે.મી. જેટલાં રોડ અને સીઓપીમાંના ભિન વહેંચાયેલા પ્રમાણસરના ભાગ સાલે, જમીન બેરિંગ રેવન્યુ સર્વે નં.૧૨૮ ઉપક કં.મી. ગામ-શોધાની, સબજીલ્લો પલસાના, જીલ્લો સ્કુદત મિલકનની સિમા ટેખાઓ : ૩(૨) નોટીસ તારીખ રખાઆ : પૂર્વ : બ્લોક નં.૧૪૬ પૈકી પૈકી ઉત્તર : પ્લોટ નં.૩૮ પશ્ચિમ : સોસાયટી આંતરિક ગેડ . ૧ ર/૦૬/૨૦૨૩ કબ્જાનો પ્રકાર : પ્રતિકાત્મક કબ્જા તારીખ : ૦૫/૦૯/૨૦૨૩

રા. ૮,૦૯,૩૨૩/-( રૂપિયા આઠ લાખ, નવ હજાર, ત્રણસોને ત્રેવીસ

પુરા)

૧૩(૨) નોટીસ તારીખ : ૧૨/૦૬/ ૨૦૨૩

કબ્જાનો પ્રકાર : સાંકેતિક કબ્જા તારીખ : ૦૫/૦૯/૨૦૨૩

૦૮/૦૬/૨૦૨૩ ના રોજ લોન ખાતાનંબરના સંદર્ભમાં : SHLHSRAT 0001251

.. શિર્ણાપ્લોટ નં.૩૬

સુરત ખાતે આવેલ મોજે

ઈટાલવા ખાતે જમીનનો

૪મીન બેરિંગ આર.એસ

નં.૧૧૧, બ્લોક નં.૧૦૩, માપણી ૧૦૮૨૫ સ્કે.મી.,

બાઘે કિઝા નામે જાણીતી

સ્કીમ, પૈકી પ્લોટ નં. દ

માપણી પર.૬૯ સ્કે.મી.

અને નોંધણી અને સબજીલ્લો પલસાના,

જીલ્લો સુરત. મિલકતની

દક્ષિણ : એડજોઇનિંગ પ્લોટ

સ્થાયી મિલકતમાંના તમામ

ભાગો અને પાર્સલો. બેરિંગ લોટનં.૪૬૧, માપણી ૭૭.૦૦ સ્કે.યાર્ડ કે.જે.પી. મુજબ બ્લોકનં.૮૨/૪૬૧ સ્કે.મી., માપણી ૬૪.૪૫

સ્કે.મી., આર્યા રેસિડેન્સી ની અંદર ૩૭.૭૦ સ્કે.મી.

જેટલા રોડ અને

સીઓપીમાંના બિન વહેંચાયેલા ભાગ સાથે

જમીન બેરિંગ આર.એસ

નં.૫૫ ઉપર સ્થિત, બ્લોક

નં.૮૨. માપની ૩૮૦૫૩

સ્કે.મી. ગામ-કારેલીના, તા.પલસાના, જી.સૂરત મિલકતની મિમારેખાઓ :

પૂર્વ : પ્લોટ નં.૭ ુ. ઉત્તર : રોડ દ્વારા પશ્ચિમ : પ્લોટ નં.પ

1. અકબર બુરહાનુદિન શૈખ ૨. શામીમ અકબર શૈખ સરનામું : કલેટ નં. ૧૦૬, પહેલાં માળ, પ્લોટ નં. ૧૮/૧૩૯૦, નવ-સર્જન સોસાયટી, તુરકીવાડ, શાહપોર, એસ.એમ.સી. ઓફિસ પાસો, સુરત-૩૯૫૦૦૩ ૦૮/૦૬/૨૦૨૩ ના રોજ લોન ખાતાનંબરના સંદર્ભમાં: SHLHSRAT 0000284 આગળના અન્ય ચાર્જિસ, ખર્ચાઓ સાથે નોટીસ મલ્યાના કલ્ દિવસની અંદર ૨ક્ક 31.

૩૯૫૦૦૩ આ પણ સરનામું ૧,૨ : પ્લોટ નં.દ, બાયે-કિઝા (સલમાન પાક) કિંગ્સ કોર્નર રેસ્ટોરન્ટ પાછળ, પલસાના સચિન હાઈવે, મોજે-ઇટાલવા, તાલુકો પલસાના, જીલ્લ સુરત-૩૯૪૩૧૫.

ઉહેર ૧૫. નં.૧નું વ્યવસાયનું આપજ્ઞ સરનામું: એપલ સિરામિક, જી-૧૩, રોયલ રેસિડેન્સી, ઉન પાટિયા ચાર રસ્તા પાસે, ઉન, સુરત-૩૯૪૨૧૦

૧. કિરણકુમાર જિતેન્દ્ર રાજપુત ૨. લિલાબેન જિતેન્દ્ર રાજપુત સરનામું ૧અને૨ : ૧૦૩, શ્રીનાથજ રેસિડેન્સી, કરડવા રોડ, ડિંડોલી, સુરત-૩૯૪૨૧૦ કિરણકુમાર જિતેન્દ્ર

૩૯૪૧૧૦ આ પણ સરનામું૧,૨∶પ્લોટ નં.૪૬૧, આર્યારેસિડેન્સી, કારેલી તળાવ પાછળ, મહાવિરનગરરેસિડેન્સીપાસે, કારેલી, પલસાના, સુરત-૩૯૪૩૧૦

૩૯૪૬૧૦ આપણ સરનામું ૧ : વિનય ફેબ, પ્લોટ નં.∉૭-૬૮, મારૂતી આઈએનડી-૨, લસ્કાના, કામરેજ રોડ, સુરત આપણ સરનામું ર શૈલેષભાઈ જારી, પ્લોટ નં. ૮ ૯, મધુનગર, લિંબાયત, સુરત -૩૯૪૨૧૦

કબ્જા તારીખ : ૦૫/૦૯/૨૦૨૩

૧૩(૨) નોટીસ ારીખ: ૧૨/૦૬ ૨૦૨૩

પૂર્વ : સોસાયટી આંતરિક રોડ. ઉત્તર: પ્લોટ નં. ૪૬ ૨ પશ્ચિમ : પ્લોટ નં. ૪૪૬

સ્થળ : સુરત

તારીખ: ૦૫.૦૯.૨૦૨૩

દક્ષિણ : પ્લોટનં ૪૬૦ સહી/- અધિકૃત અધિકારી